

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને વર્ષ 2020 માટે મજબૂત AAA ક્રેડિટ રેટિંગ જાળવ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 16, 2020) – ગઈકાલે, [S&P ગ્લોબલ રેટિંગ્સ \(S&P\)](#) દ્વારા સીટી ઓફ બ્રેમ્પટનને વર્ષ 2020 માટે [ટ્રિપલ 'A' રેટિંગ](#), એક સ્થિર દૃષ્ટિબિંદુ દર્શાવતું, એક મ્યુનિસિપાલિટીને મળી શકતું સર્વોત્તમ ક્રેડિટ રેટિંગની ઘોષણા કરવામાં આવી. S&P અનુસાર, આ રેટિંગ આપણાં શહેરની મજબૂત અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થાપન વ્યવહારોને પ્રતિબિંબિત કરે છે, જેનાથી COVID-19 વૈશ્વિક મહામારીમાંથી શહેરની રિક્વરીને ટેકો મળશે.

ઝાંખીઓ

S&P દ્વારા શહેરના મજબૂત ક્રેડિટ રેટિંગમાં ફાળો આપતા પરિબલોમાં સામેલ છે:

- અપવાદમય પ્રવાહિતા સ્થિતિ, જે ઋણ સેવાનો વ્યાપ સમોવડિયા શહેરો કરતા વધારે મજબૂત હોવાનું સૂચવે છે.
- સારી સામાજિક-આર્થિક અને વસ્તીવિષયક લાક્ષણિકતાઓની સાથે, રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે જુવાન વસ્તી અને તંદુરસ્ત વસ્તીમાં વૃદ્ધિ, મોટા બજારોથી નિકટતા, અને સ્પર્ધાત્મક કર દરોથી આ વિસ્તારમાં નવા ધંધાઓ આકર્ષાય છે અને રોજગારની તકો વધે છે.
- પહોંચ સુલભ સ્પષ્ટીકરણથી માંડીને પ્રસંગોચિત માહિતી, અને વિગતવાર સંચાલન અને મૂડી રોકાણો.

સ્થિર દૃષ્ટિકોણ ધરાવતું રેટિંગ S&P ની એ અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે કે COVID-19 નાં પ્રતિબંધો સરળ બને એટલે, બ્રેમ્પટનના અર્થતંત્રને આગામી બે વર્ષોમાં પોતાનો વેગ ફરીથી મળશે, જે શહેરની મજબૂત અંદાજપત્રલક્ષી કામગીરી અને તંદુરસ્ત પ્રવાહિતા સ્થિતિને સહાયરૂપ બનશે.

અવતરણો (ક્વોટ્સ):

“ગયા બે વર્ષોમાં, આપણી કાઉન્સિલે શહેરના સુદૃઢ નાણાકીય સંચાલન વ્યવહારોને ટેકો આપતી કાર્યવાહીઓ કરી છે. લગભગ 20 વર્ષોમાં પહેલી વખત, અનામત ભંડોળમાં રેકોર્ડ ફાળો આપીને, આપણે કર અચળ રાખ્યો (ટેક્સ ફ્રીઝ કર્યો) અને તે સતત બે વર્ષો સુધી કરી શક્યા છીએ. આપણે વૈલ્યુ ફોર મની (નાણાંનું મૂલ્ય) ઓડિટ પણ કર્યું જેનાથી \$7.2 મિલિયન સંભવિત બચતમાં, અને કેપિટલ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી જેનાથી \$9.3 મિલિયન ભંડોળમાં ઓળખી કાઢ્યા જે પરત કરવાના રહેશે અને નવી પહેલો માટે ઉપયોગમાં લેવાશે, અને વધુ સમીક્ષા માટે \$10.5 મિલિયન પણ ઓળખી કાઢ્યા. અમે બ્રેમ્પટનને વૈલ-રન (સુસંચાલિત) શહેર બનાવી રાખતા પ્રયત્નો કરવાનું, અને વૈશ્વિક મહામારીમાંથી આપણી રિક્વરીને ચલિત કરવામાં મદદરૂપ થવાનું ચાલુ રાખીશું.”

– *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“વૈશ્વિક મહામારી શરૂ થતા પહેલાંના અમારા પ્રયત્નોએ શહેરનું અનામત ભંડોળ મજબૂત કર્યું હતું અને તેનાથી આજે આપણે જોઈએ છીએ તેવા અણધાર્યા પડકારોનો સામનો કરવામાં પણ, આપણી નાણાકીય સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળી. કેનેડામાં સૌથી ઝડપી વિકસતા શહેરોમાંથી એક, ઈનોવેશન કોરિડોર પર સ્થિત તરીકે, બ્રેમ્પટન એક મહત્વનું વિકાસ હબ બની રહે છે જે પ્રતિભા અને વિવિધતાને પોષે છે.”

– *હરકિરત સિંઘ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“અમે અમારા સંચાલનોનું આધુનિકીકરણ કરતી વખતે ખર્ચાઓને કાળજીપૂર્વક સંતુલિત કરીને શહેરને કાર્યક્ષમ રીતે ચલાવવાના પ્રયત્નો કર્યા છે. બ્રેમ્પટનને આગળ વધારવાનું અને આપણાં રહેવાસીઓ, ધંધાઓ અને રોકાણકારોને વધારે સારી સહાયતા ચાલુ રાખવા, ખાસ કરીને આપણે COVID-19 નાં પ્રભાવોથી રિક્વર થઈ રહ્યાં છીએ ત્યારે – અમે સર્વિસ અને નાણાકીય ઉત્કૃષ્ટતાને અગ્રતા આપવા કટિબદ્ધ છીએ.”

– *ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca